

<p>૨ અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો</p>	<p>અધિકારીઓ અને કર્મચારીઓની ફરજ નીચે મજબ છે:</p> <p>કયુરેટર (કિલ્લો)</p> <ul style="list-style-type: none"> • કિલ્લા ખાતે મુલાકાતીઓને સાંભળવા તેમજ સમજ આપવી. • કિલ્લામાં આવેલ આર્ટ ગેલેરી, કોન્ફરન્સ રૂમને જે તે સમયે ભાડે આપવામાં આવે ત્યારે તેની નોંધ રાખવી. • ઉપરી અધિકારીઓ તરફથી મળતી લેખિત/મૌખિક સુચનાનું પાલન કરવું. • કિલ્લા ખાતે ઈન્સ્યોરન્સ અને હાઉસકીપીંગની કામગીરી અને તેને લગતા રીપોર્ટ. • વહીવટી કામગીરી જેવી કે મહેકમ, વેબસાઈટ, ડેડ સ્ટોક, સ્ટોર્સ વિગેરેનાં રિપોર્ટ • તાબા હેથળના કર્મચારીની રજા મંજૂર કરવી. • કિલ્લાના ટેન્ડર અને કવોટેશનની કામગીરી કરવી. • વખતો વખત ટેમ્પરરી એક્ઝિબિશનનું આયોજન, સ્કુલના બાળકોને પ્રોત્સાહિત કરવા સ્કુલ સાથે સંકલન કરી કાર્યક્રમનું આયોજન. • આર્ટ ગેલેરી, કોન્ફરન્સ રૂમમાં કોઈ કાર્યક્રમ હોય ત્યારે જરૂર જાણાયે હાજર રહેવું અને રીપોર્ટ રજૂ કરવા. • કિલ્લાના ઈન્સ્યોરન્સની કામગીરી • રાઇટ ટુ ઈન્ફોર્મેશનને લગતી કામગીરી કરવી. • વખતો વખત ખાતાના વડાશ્રી દ્વારા જે કોઈ કામગીરી લેખિત/ મૌખિક સુચના આપી સૌંપવામાં આવે તે તમામ કામગીરીઓ કરવાની રહેશે. <p>આસી. ઈજનેર (ઈલેક્ટ્રીકલ) (ઓન લોન)</p> <ul style="list-style-type: none"> • કિલ્લા ખાતે વિવિધ ઈલેક્ટ્રીકલ સાધનોની જાળવણી કરાવવી. • ટોરેન્ટ પાવર લિ. સાથે પત્રવ્યવહાર કરવો. • કિલ્લા ખાતને લગતી ઈલેક્ટ્રીકલ અને CCTV, HVAC, ડ્રો-બ્લિઝ વિગેરે સાધન-સામગ્રીની જાળવણી અને એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ (AMC) અંગેની કામગીરી કરવી. • કિલ્લા સ્થિત આર્ટ ગેલેરી, કોન્ફરન્સ રૂમમાં જાહેર મુખ્ય કાર્યક્રમો દરમ્યાન હાજર રહેવું અને ઈલેક્ટ્રીકલ અને એરકુન્ડીશનીગની દેખરેખ કરાવવી. • વખતો વખત ખાતાના વડાશ્રી દ્વારા જે કોઈ કામગીરી લેખિત/ મૌખિક સુચના આપી સૌંપવામાં આવે તે તમામ કામગીરીઓ કરવાની રહેશે. <p>ગેલેરી આસીસ્ટન્ટ (ઓન લોન)</p> <ul style="list-style-type: none"> • કિલ્લા ખાતે આવેલ ગેલેરીઓનાં શોકેસની જાળવણી, ડીસ્કેની કામગીરી, મુલાકાતીઓને માર્ગદર્શન આપવું. • કિલ્લાના ડોક્યુમેન્ટેશનને લગતી દરેક પ્રકારની કામગીરી કરવી. • કિલ્લાની મુલાકાતે આવતા ડેલીગેશન તથા વિશેષ અતિથીઓની સાથે રહી સમજ આપવી. • વખતોવખત સુરત મહાનગરપાલિકાના ઉપરી અધિકારીશ્રી, ખાતાના વડાશ્રી
--	--

	<p>/ ચીફ કયરેટરશ્રી / કયરેટર (મ્યુઝિયમ) /કયરેટર (કિલ્વો) દ્વારા જે કોઈ કામગીરી લેખિત / મૌખિક સૂચના આપી સોંપવામા આવે તે તમામ કામગીરીઓ કરવાની રહેશે.</p> <p>મેઈન્ટેનન્સ આસી. (ઇલેક્ટ્રીકલ) (ઓન લોન)</p> <ul style="list-style-type: none"> કિલ્વા ખાતેના વિવિધ ઇલેક્ટ્રીકલ CCTV, HVAC, ડ્રો-બ્લિજ વિગેરે સાધન-સામગ્રીનું મેઈન્ટેનન્સ કરવું તથા દેખરેખ રાખવી. કિલ્વા ખાતેના ઇલેક્ટ્રીકલ / એરકન્ડીશનીંગ બાબતના વિવિધ કામો બાબતે ઉપરી અધિકારી / આસી.ઇજનેર(ઇલે.)ની કામગીરીમાં મદદરૂપ થવું અને ઇલેક્ટ્રીકલ સ્ટાફની કામગીરી ઉપર દેખરેખ રાખવી અને જરૂરી સૂચના આપવી. કિલ્વા સ્થિત આર્ટ ગેલેરી, કોન્ફરન્સ રૂમ તથા જાહેર કાર્યક્રમોમાં ઉપસ્થિત રહીને ઇલેક્ટ્રીકલ અને એરકન્ડીશનીંગની કામગીરીની દેખરેખ રાખવી. <p>ડેડ કલાર્ક (ખાલી)</p> <ul style="list-style-type: none"> સોવીનીયર શોપને લગતી તમામ પ્રકારની કામગીરી કરવી અને કરાવવી, દરેક પ્રકારનાં શોપનાં રજીસ્ટરો તૈયાર કરવા, ડેડ સ્ટોક રજીસ્ટરની કામગીરી. શિષ્ટતાનું પાલન કરાવવું તથા વખતો વખત ખાતાના વડાશી/ અધિકારીશી દ્વારા જે કોઈ કામગીરી લેખિત/ મૌખિક સૂચના આપી સોંપવામાં આવે તે તમામ કામગીરીઓ કરવાની રહેશે. કિલ્વા ખાતે સ્થિત આર્ટ ગેલેરી કમ એક્ઝિબીશન હોલ અને કોન્ફરન્સ રૂમમાં તેમજ કિલ્વાના પરિસરમાં કાર્યક્રમ હોય તે દરમિયાન હાજર રહેવું. <p>સીનીયર કલાર્ક (ખાલી)</p> <ul style="list-style-type: none"> કિલ્વાના ઇન્સ્યોરન્સનાની કામગીરી તેમજ ઇન્સ્યોરન્સની પોલીસી રીન્યુ કરાવવી તથા તેને લગતી કામગીરી કરવી. દરખાસ્ત તૈયાર કરવી, બજેટને લગતી કામગીરી, પ્રિમાયસીસ લાઈસન્સ અંગેની કામગીરી કરવી, ખર્ચ પત્રકની કામગીરી કરવી, ડેડ સ્ટોક રજીસ્ટર, સેન્ટ્રલ સ્ટોરને લગતી કામગીરી કરવી. આર્ટ ગેલેરી / કોન્ફરન્સ રૂમ બુક કરાવવા આવેલ મુલાકાતી /સંસ્થાને આર્ટ ગેલેરી / કોન્ફરન્સ રૂમની માહિતી આપવી, E.C ની કામગીરી કરવી. <p>ત્રીજી શ્રેણી કલાર્ક (૨)</p> <ul style="list-style-type: none"> હાઉસ કિપીંગના બીલ બનાવવાની કામગીરી, કોમ્પ્યુટર ઓપરેટરની હાજરી, તથા ઇન્સ્યોરન્સની કામગીરી કરવી. તમામ ટેન્ડરોની ફાઈલ ચલાવવી તેની EMD, સીક્યુરિટી ડીપોર્ટ જમા કરાવવી. કિલ્વાના ટિકિટ વિન્ડો ઉપર કિલ્વો જોવા આવતા મુલાકાતીઓને ટિકિટ ઇસ્યુ કરવી, ટિકિટો અંગેનું સ્ટોક રજીસ્ટર તૈયાર કરવાની કામગીરી, ભરણા અંગેની કામગીરી, આવક અંગેના રજીસ્ટરો બનાવવા, નિભાવવા તથા
--	---

		<p>આવેલ રકમનું ભરણું કરવું કિલ્લામાં આવેલ આર્ટ ગેલેરી, કોન્ફરન્સ રૂમના બુકીગની, ફોટોગ્રાફી, વિડિયોગ્રાફી વિગેરેના બીલ બનાવવાની કામગીરી કરવી. કિલ્લાની મુલાકાતે આવનાર બાળકો તથા શિક્ષકોના બુકીગ તેમજ અન્ય ચૂપ બુકીંગ અંગેની કામગીરી કરવી તથા ભરણાની કામગીરી કરવી.</p> <ul style="list-style-type: none"> આઉટવર્ક-ઈનવર્કની કામગીરી કરવી. બહારથી આવતી ટપાલોના વિતરણાની કામગીરી બાઈન્ડરો, ફાઇલો નોંધી ખાતાના વડાશ્રી/અધિકારીશ્રીની સહીમાં મુકવા. વખતોવખત ખાતાના વડાશ્રી/અધિકારીશ્રી દારા જે કોઈ કામગીરી લેખિત/મૌખિક સૂચના આપી સોંપવામાં આવે તે તમામ કામગીરીઓ કરવાની રહેશે. <p>વાયરમેન (૩)</p> <ul style="list-style-type: none"> કિલ્લા ખાતેના વિવિધ ઈલેક્ટ્રોિકલ અને એરકન્ડીશનીંગ ઈક્વીપમેન્ટનું ઓપરેટીંગ અને મેઈન્ટેનન્સની કામગીરી આર્ટ ગેલેરી, કોન્ફરન્સ રૂમમાં પ્રોગ્રામ સમયે હાજર રહી ઈલેક્ટ્રોિકલ / એરકન્ડીશનીંગ, સાઉન્ડ સીસ્ટમ અંગેની કામગીરી કરવી. <p>પટાવાળા (૧૧)</p> <ul style="list-style-type: none"> કિલ્લા ખાતેની વહીવટી ઓફિસમાં ફાઈલો ગોઠવવી, રીપોર્ટ ફાઈલમાં ફાઈલ કરવા, કિલ્લાના વિવિધ ભાગોની ચાવી લાવી ગેલેરીઓ ખોલવી. ટપાલની કામગીરી, મુલાકાતીઓને લાઈનમાં ઉભા રાખવા તેમજ ગેલેરીઓ, આર્ટ ગેલેરી, કોન્ફરન્સ રૂમ, વોલ્ટ રૂમમાં મુલાકાતીઓની તકેદારી રાખવી. એક્જિબીટસના પ્રદર્શનમાં મદદ કરવી અને ઉપરી અધિકારીઓની સુચના મૂજબ કામગીરી કરવી.
૪	કર્મચારીઓની કામગીરી અને ફરજો અંગેની કાર્યપ્રણાલી	<p>સોવેનીયર શોપ</p> <ul style="list-style-type: none"> કિલ્લા ખાતે સ્ટોલ એરીયામાં સોવેનીયર શોપ આવેલ છે. આ સોવેનીયર શોપમાં શહેરીજનોને ગ્રામ્ય હેન્ડી કાફિટ તથા સુરત મહાનગરપાલિકાના પણ્ણીકેશન જેમ કે 'At The Core' અને 'A Tale Of Surat's Heritage', પોસ્ટકાર્ડ, ફોટોફેલ્મ અને કોઝી-મગ વિગેરે પણ વેચાણ અર્થે મૂકવામાં આવેલ છે. <p>આર્ટ ગેલેરી કમ એક્જિબીશન હોલ</p> <ul style="list-style-type: none"> આર્ટ ગેલેરી કમ એક્જિબીશન હોલ એ-૪ બિલ્ડીગના ભૌંયતળીયામાં આવેલ છે. તેનો અંદાજીત વિસ્તાર ૨૬૫ ચો.મીટર ધરાવે છે તથા સંપૂર્ણપણે વાતાનીકુલીત છે. આર્ટ ગેલેરી કમ એક્જિબીશન હોલમાં સ્થાનિક કલાકારો પોતાની કલા પ્રદર્શિત કરી શકશે તેમજ વિવિધ પ્રકારના પ્રદર્શન સહ વેચાણ જેવા કાર્યક્રમના આયોજન માટે આદર્શ વ્યવસ્થા ધરાવે છે. <p>કોન્ફરન્સ રૂમ</p> <ul style="list-style-type: none"> કોન્ફરન્સ રૂમ એ-૪ બિલ્ડીગના પ્રથમ માળ પર આવેલ છે, તથા ૪૦-૫૦ વ્યક્તિની બેઠક વ્યવસ્થા ધરાવે છે. આ વ્યવસ્થા શૈક્ષણિક કાર્યક્રમ /

		<p>સાહિત્યિક / સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જેવી કે સંવાદ, વર્ક્ષોપ, મીટિંગ, જુથ ચર્ચા, પ્રેઝન્ટેશન, સાહિત્ય ગોષ્ઠી, પુસ્તક વિમોચન વિગેરે કાર્યક્રમ માટે આર્દ્ધ વ્યવસ્થા છે.</p>
૫	જાહેર તંત્ર અને કર્મચારીઓએ નિયંત્રણ હેઠળના અનુસરવાના નિતી નિયમો, સુચનો, મેન્યુઅલ્સ અને રેકર્ડો.	<p>૧. બી.પી.એમ.સી.એક્ટ, ૧૯૪૮ ૨. સામાન્ય સમાનાં દરાવ ૩. સ્થાયી સમિતિનાં દરાવ ૪. સાંસ્કૃતિક સમિતિનાં દરાવ તથા જાહેર બાંધકામ સમિતિના દરાવ ૫. કિલ્લાના નિતી – નિયમો</p> <ul style="list-style-type: none"> કિલ્લાની અંદર સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી કિલ્લા પ્રિમાઈસીસમાં કોઈપણ પ્રકારના ખાદ્ય પ્રદાનો, ડાપીણા, પાન મસાલા, ગુટખા, પ્લાસ્ટીક પાઉચ, કેરી બેગ્સ તથા અન્ય પ્રદૂષિત વસ્તુ લઈ જવા દેવામાં આવશે નહીં. બહારના ફેરીયાઓને કે સ્વયં સેવકોને કોઈપણ ખાવાપીવાની વસ્તુઓ વેચવા / વિતરણ કરવા દેવામાં આવશે નહીં. થેલીઓ, પાણીની થેલીઓ પાણીની બોટલો, વિગેરે કિલ્લાની મુલાકાત દરમ્યાન સાથે લઈ જવા દેવામાં આવશે નહીં. કિલ્લાની વિઝીટ દરમ્યાન શાંતિ રાખવી, મોબાઈલ ઉપર વાતો કરવાની મનાઈ, તેમજ મોબાઈલ સાયલન્ટ મોડ ઉપર રાખવો, થુંકવાની તથા ધૂમ્રપાન કરવાની સખ્ત મનાઈ છે. મુલાકાતીઓ જો કિલ્લામાં પાન મસાલા ખાતા પકડાશે કે પિચકારી મારતા પકડાશે તો નીતી નિયમો અનુસાર દડને પાત્ર રહેશે. સક્ષમ અધિકારીની પરવાનગી વગર ફોટો / વીડીયો શુટીંગ કરવા દેવામાં આવશે નહીં. કોઈપણ પ્રકારની ફરિયાદ / સુચનો લેખિતમાં જણાવવી. મુલાકાતીઓએ તમામ સ્ટાફ જોડે વિવેકપૂર્ણ રીતે વર્તવું, ફરિયાદ અથવા સુચન ફરિયાદ બુકમાં લખવા. સીક્યુરીટી સ્ટાફ કે ફરજ પરનાં સ્ટાફ સાથે ગેરવર્તણુક કે જઘડો કરવો નહીં. પાણેલા પ્રાણીઓ સાથે પ્રવેશ આપવામાં આવશે નહીં. ટીકીટ લીધા પછી પ્રવેશ મેળવ્યા બાદ દરેક મુલાકાતીએ ટીકીટ કિલ્લો છોડતા સુધી પોતાની પાસે રાખવાની રહેશે. કિલ્લાનો સમય મા.કમિશનરશી વખતો વખત નક્કી કરે, એ મુજબનો રાખવામાં આવશે. એક વખત ટીકીટ લીધા બાદ ટીકીટ પરત લેવામાં આવશે નહીં કે નાણાં પરત આપવામાં આવશે નહીં. પ્રવેશ મેળવ્યા બાદ આકસ્મિક સંજોગોમાં કિલ્લો બંધ કરવામાં આવે તો રીફ્ડ ન આપતા ફરી કાર્યરત થતા એ જ ટીકીટ પર પ્રવેશ મેળવવાનો રહેશે. કુદરતી આફિતોના કારણે અગર જાહેર સુલેહ શાંતિ જોખમાય તેવા અસામાન્ય સંજોગોમાં કિલ્લો બંધ કરવાની પરિસ્થિતિ ઊભી થાય તો તેવા સંજોગોમાં પ્રવેશ ટીકીટની પુરેપુરી રકમનું રીફ્ડ આપવાની અથવા તારીખની ફરબદ્ધી કરી આપવાની સત્તા મ્યુ.કમિશનરશી કે તેઓના અધિકૃત અધિકારીશ્રીનો નિર્ણય આખરી બંધનકર્તા ગણાશે. કિલ્લાની મિલકતને કે સાધનોને કોઈપણ પ્રકારનું નુકશાન થાય તો

	<p>મ્યુ.કમિશનરશ્રી અથવા અધિકારીશ્રી તેની કરેલ આકારણીની રકમ એટલે થયેલ નુકશાનની રકમ મુલાકાતી પાસેથી વસુલ કરી શકશો. અન્યથા જરૂર જણાય તો પોતીસ કાર્યવાહી કરવાને પાત્ર રહેશે.</p> <ul style="list-style-type: none"> • કિલ્લાની મુલાકાત દરમ્યાન આકસ્મિક સંજોગોમાં કોઈ દુર્ઘટના સર્જાયને તેના થકી કોઈપણ મુલાકાતીને નુકશાન થાય તો તેની જવાબદારી સુરત મહાનગરપાલિકા રહેશે નહીં. • કિલ્લાના તમામ નિયમોનાં અર્થઘટન માટે અને તેમાંથી ઉપસ્થિત થતી કોઈપણ બાબતમાં મ્યુ.કમિશનરશ્રીનો નિર્ણય આખરી અને બંધનકર્તા ગણશે. જેના ભંગ બદલ મ્યુ.કમિશનરશ્રી / અધિકૃત અધિકારી દંડ કરી શકશે. • પાર્કિંગ ચાર્જાસ જે તે સમયે નક્કી કરવામાં આવેલ હોય તે મુજબ ચૂકવવાના રહેશે. • ટીકીટબારી છોડતા પહેલા ટીકીટ અને પૈસા ચકાસી લેવા. <p>નોંધ:- દરેક પ્રવેશ ફોટો ઓળખકાર્ડ આધારિત રાખવો જરૂરી છે, જેથી ઉપર મુજબ વય મર્યાદાની ચકાસણી કરી શકાય તેમજ સલામતીના ચુસ્ત ધારાધોરણનો અમલ પણ થઈ શકે, ત વર્ષ સુધીના બાળકો માટે ઓળખકાર્ડ જરૂરી નથી. (ઓળખકાર્ડ સામાન્યતઃ ચુંટણી ઓળખકાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, ઈન્કમટેક્ષ પાન કાર્ડ વિગેરે), શાળાના વિદ્યાર્થીઓના સંદર્ભે વિદ્યાર્થીઓનું ઓળખ પત્ર તેમજ શાળાના આચાર્ય / જવાબદાર કર્મચારી દ્વારા શાળાના લેટરપેડ પર વિદ્યાર્થીઓની સંખ્યા, નામ અને અભ્યાસનું ધોરણ જણાવવાનું રહેશે.</p>
--	--